



MBG-002-001202

Seat No. \_\_\_\_\_

**B. Com. (Sem. II) (CBCS) Examination**

**March / April - 2018**

**Business Economics - 2**

*(Old Course)*

**Faculty Code : 002**

**Subject Code : 001202**

Time :  $2\frac{1}{2}$  Hours]

[Total Marks : 70

૧ પૂર્ણ હરીફાઈવાળા બજારમાં લાંબાગાળામાં પેટ્ટી અને ઉદ્યોગની સમતુલા સમજાવો. ૨૦

**અથવા**

૧ (અ) ઈજારાયુક્ત હરીફાઈનાં લક્ષણો તપાસો ૧૦

(બ) ઈજારાનો અર્થ સ્પષ્ટ કરી ઈજારાનાં લક્ષણો સમજાવો. ૧૦

૨ કિંમત ભેદભાવ એટલે શું ? કિંમત ભેદભાવ ક્યારે શક્ય અને નફાકારક બને છે ? ૨૦

**અથવા**

૨ (અ) વેચાણખર્ચની માંગરેખાના વક્ર ઉપરની અસરો આકૃતિની મદદથી સમજાવો. ૧૦

(બ) ખાંચાવાળી માંગરેખાના સિદ્ધાંત હેઠળ કિંમત જડતા સમજાવો. ૧૦

૩ વહેચણીનો સીમાંત ઉત્પાદકતાનો સિદ્ધાંત સમજાવો. ૧૫

**અથવા**

૩ (અ) વ્યાજના દરને અસર કરતાં પરિબળની ચર્ચા કરો. ૮

(બ) વાસ્તવિક વેતનને અસર કરતાં પરિબળોની ચર્ચા કરો. ૭

૪ ભાડાનો આધુનિક સિદ્ધાંત સમજાવો. ૧૫

**અથવા**

૪ (અ) નફાનો જોખમ અને અનિશ્ચિતતાનો સિદ્ધાંત સમજાવો. ૮

(બ) નફાનો અર્થ સ્પષ્ટ કરો અને કાચો નફો (હિસાબી નફો) તેમજ ૭

ચોખ્ખા નફા (આર્થિક નફો) વચ્ચેનો ભેદ સમજાવો ?

## ENGLISH VERSION

- 1 Explain the equilibrium of the firm and industry in the long run under perfect competition ? 20

**OR**

- 1 (a) Explain the characteristics of monopolistic competition. 10  
(b) Explain the meaning of monopoly and its characteristics. 10

- 2 What is price discrimination ? When does it become possible and profitable ? 20

**OR**

- 2 (a) Explain the effects of selling cost on demand curve with the help of diagram ? 10  
(b) Explain the price rigidity under the law of kinked demand curve. 10

- 3 Explain the principle of marginal productivity of distribution. 15

**OR**

- 3 (a) Explain the factors affecting the rate of interest. 8  
(b) Explain the factors affecting the rate of real wages. 7

- 4 Explain the modern theory of rent. 15

**OR**

- 4 (a) Explain the profit theory risk and uncertainty. 8  
(b) Clarify the meaning of profit and show the difference between gross profit and net profit ? 7